KJ- 192

" ॐ "

શ્રી. [illegible] તા ૨૦-૩-૪૬

સં. ૨૦૦૨ ના ફાગણ સુદ ૭ ને રવિવાર ના રોજે. [illegible] ના

[illegible] ને તે શાળામાં [illegible]

[illegible] જુબલ

સ્તુતિ –

[illegible]

ઠેકો – [illegible]

[illegible]

[illegible]

[illegible]

Real Patidar Library

About Real Patidar books

KJ-192

॥ ૐ ॥

શ્રી. ઉંઝાથી તા ૨૦-૩-૪૬

સં. ૨૦૦૨ ના. ફાગણ સુદ ૭ ને રવિવાર ના રોજ. [illegible] રોજ ના
શુમારે [illegible] જાહેર સભા. બોલાવવામાં આવેલ ને તે સભામાં
પ્રમુખ [illegible] નીચે મુજબ

સ્તુતિ -
[illegible]

ઠરાવ — [illegible]

પ્રમુખ — [illegible]

[illegible] [illegible]

[illegible] [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]